

આત્મ નિર્ભર ગુજરાત સહાય યોજના-હાઈલાઈટ્સ

- નોવેલ કોરોના વાઈરસ (COVID-19) ની પરિસ્થિતિમાં આર્થિક મુશ્કેલી અનુભવી રહેલા નાના વેપારીઓ, મધ્યમ વર્ગની વ્યક્તિઓ, વ્યક્તિગત કારીગરો, શ્રમિક વર્ગને બિન તારણ ધિરાણ ઉપર વ્યાજ સહાય માટે 'આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના' જાહેર કરવામાં આવે છે.
- રાજ્યની સહકારી બેંકો તથા ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીઓ મારફત ૮% વ્યાજના દરે રૂ.૧,૦૦,૦૦૦/- સુધીનું બિનતારણ ધિરાણ આપવામાં આવશે.
- રાજ્ય સરકાર દ્વારા લાભાર્થીના લોન ખાતામાં વાર્ષિક ૬% વ્યાજ સહાય જમા આપવામાં આવશે.
- ધિરાણ લેનાર લાભાર્થીએ માત્ર વાર્ષિક ૨% વ્યાજ ભરવાનું રહેશે.
- આ ધિરાણ લાભાર્થીએ ૩ વર્ષના સમયગાળામાં પરત કરવાનું રહેશે. જેમાં લાભાર્થીઓને ૬ માસનો મોરેટોરીયમ પિરીયડ આપવામાં આવશે. આ સમયગાળા દરમિયાન કોઈ હપ્તા ભરવાના રહેશે નહીં. ત્યારબાદ ૩૦ સરખા માસિક હપ્તામાં લાભાર્થીએ લોનની રકમ પરત ચુકવવાની રહેશે.
- આ યોજના તા. ૨૧/૦૫/૨૦૨૦થી કાર્યરત થશે.
- આ યોજના હેઠળ લાભાર્થીઓએ તા.૩૧/૦૮/૨૦૨૦ સુધીમાં સંબંધિત નાગરીક સહકારી બેંક/જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક/ગુજરાત રાજ્ય સહકારી બેંકની સંબંધિત શાખાને/સંબંધિત ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.
- લાભાર્થી તરફથી મળેલ તમામ અરજીઓનો નિર્ણય મોડામાં મોડા તા.૩૧/૧૦/૨૦૨૦ સુધીમાં કરવાનો રહેશે.
- મંજૂર કરવામાં આવેલ અરજીઓના ધિરાણની રકમનું disbursement તા.૧૫/૧૧/૨૦૨૦ સુધીમાં કરવાનું રહેશે.
- અરજી ફોર્મ લાભાર્થીઓને વિના મૂલ્યે સહકારી બેંકો/ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીઓ દ્વારા પુરુ પાડવામાં આવશે.
- લાભાર્થીને સ્ટેમ્પ ફીની કોઈ રકમ ચુકવવાની રહેશે નહીં.
- આ યોજનાના સુચારુ અમલીકરણ તથા ફરિયાદ નિવારણ માટે નાગરીક સહકારી બેંકોના કિસ્સામાં નોડલ એજન્સી તરીકે ધી ગુજરાત અર્બન કો.ઓપરેટીવ બેંક્સ ફેડરેશન.
- જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો માટે નોડલ એજન્સી તરીકે ધી ગુજરાત રાજ્ય સહકારી બેંક લી. રહેશે.

- કેડીટ કો.ઓપરેટીવ સોસાયટીઓના કિસ્સામાં નોડલ એજન્સી તરીકે સંબંધિત જિલ્લા રજિસ્ટ્રાર રહેશે.
- નોડલ એજન્સી દ્વારા Toll free no. ની સુવિધા ઉભી કરવાની રહેશે.
- હયાત વ્યવસાયમાં કાર્યરત હોય તેઓને આ યોજના હેઠળ ધિરાણ મળી શકશે. આ અંગે લાભાર્થી તા.૦૧/૦૧/૨૦૨૦ ના રોજ હયાત વ્યવસાયમાં કાર્યરત હોવા જોઈએ.
- સદરહુ યોજના હેઠળ લોન મેળવનાર લાભાર્થીની હાલની ચાલુ લોન મુદતવીતી હોવી જોઈએ નહીં.
- કેન્દ્ર તથા રાજ્ય સરકારની કચેરીઓ/અર્ધ સરકારી કચેરીઓ તથા સ્થાનિક સત્તા મંડળની કચેરીઓમાં તેમજ કેન્દ્ર તથા રાજ્ય સરકારના બોર્ડ/કોર્પોરેશનમાં તથા તમામ બેંકોમાં ફરજ બજાવતાં કર્મચારીઓને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે નહિ. ઉપરોક્ત કચેરીઓ/બેંકોમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર/એડહોક ધોરણે કામ કરતી વ્યક્તિઓને પણ આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે નહીં.
- આ યોજના હેઠળ અંદાજિત ૧૦,૦૦,૦૦૦ (દસ લાખ) લાભાર્થીઓને લાભ મળશે. યોજના હેઠળ લાભાર્થીઓને અંદાજિત રૂ.૫૦૦૦ કરોડનું ધિરાણ વાર્ષિક ૨% વ્યાજ દરે મળશે. લાભાર્થીઓને યોજના અંતર્ગત અંદાજિત રૂ.૩૩૦ કરોડ રકમની વ્યાજ સહાય મળશે.